

**આર.બી.આઈ અલવર અર્બન કો ઓપરેટિવ બેંક લિમિટેડ, અલવર (રાજસ્થાન)
ને નિર્દેશો જારી કરે છે**

આથી જાહેર જનતા ને જણાવવામાં આવે છે કે બેંકિંગ રેગ્યુલેશન એક્ટ 1949 (AACS) ની કલમ 35 A ની પેટા કલમ (1) ને કલમ 56 સાથે વાંચતાં મળેલ સત્તા હેઠળ ભારતીય રિઝર્વ બેંકે અલવર અર્બન કો ઓપરેટિવ બેંક લિમિટેડ, અલવર, ને નિર્દેશો જારી કર્યા છે જેમાં માર્ચ 07, 2017 ના કામકાજ ના સમય ના અંત થી ઉપરોક્ત બેંક આરબીઆઈ ની લેખિત મંજૂરી સિવાય, કોઈપણ લોન માંજૂર કે તેનું નવીનીકરણ, ધિરાણ, રોકાણ, કોઈપણ જવાબદારી ઊભી કરવી, જેમાં ભંડોળ ઉધાર લેવું અને નવી ડિપોઝિટ સ્વીકારવાનો સમાવેશ થાય છે, પોતાની જવાબદારી કે ફરજ ના ભાગરૂપે કે અન્ય રીતે ચુકવણી કે ચુકવણી કરવા સમત થવું, કોઈ સમાધાન કે કરાર કરીને પોતાની મિલકતો કે અસ્કયામતો નું વેચાણ, આર.બી.આઈ ના તારીખ માર્ચ 01, 2017 ના નિર્દેશ મો જણાવ્યા સિવાય નું, કે જેની નકલ રસધરાવતા જનતા ના સભ્યો ના અવલોકન માટે બેંકના મકાન માં પ્રદર્શિત કરેલ છે, કરવું નહીં. આર.બી.આઈ ના ઉપરોક્ત નિર્દેશ માં જણાવ્યા પ્રમાણે કેટલીક શરતો ને આધીન દરેક બચત અથવા ચાલુ ખાતા અથવા અન્ય કોઈ ડિપોઝિટ ખાતા માં કુલ જમા રકમ માંથી ₹ 1,000/- (રૂપિયા એક હજાર પૂરા) સુધી નો ઉપાડ કરવા ની મંજૂરી છે.

જારી કરાયેલ ઉપરના નિર્દેશોનું અર્થઘટન રિઝર્વ બેંક દ્વારા બેંકિંગ લાયસન્સ રદ કરવા તરફ ન કરવું જોઈએ. બેંક તેની નાણાંકીય સ્થિતિમાં સુધારો થાય ત્યાં સુધી નિયંત્રણો સાથે બેંકિંગ કારોબાર (Business) ચાલુ રાખશે. સંજોગોના આધારે રિઝર્વ બેંક આ નિર્દેશોમાં સુધારાઓ અંગે વિચારણા કરી શકે છે.

અનિરુદ્ધ ડી. જાધવ

સહાયક પ્રબંધક